



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૮/૦૫/૨૦૧૯ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૭૯૪/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૮ કેસ કરી, ૪૪ વ્યક્તિઓને ઝડપી, ૪૧૫ લીટર દેશી દારૂ અને ૧ સ્કુટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૪ કેસ કરી ૯ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૬,૧૨૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૭૯૫/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૬૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૭૯૬/૧૯

નવરંગપુરા: વિકાસ હરિવંશ સીંગ (ઉ.વ.૩૯)(રહે.કેના કોમ્પ્લેક્ષ આઇ.સી.આઇ.સી.આઇ. બેન્ક સામે મોટેરા રોડ સાબરમતી) એ તા.૦૭/૦૫/૧૯ નારોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે ફેબ્રુઆરી/૨૦૧૯ થી આજદિન સુધીના સમયગાળા દરમ્યાન નવરંગપુરા આશ્રમ રોડ સેલ્સ ઇન્ડીયાની બાજુમાં મોતીલાલ સેન્ટર છઠ્ઠે માળ ઓફીસ નં-૮ ખાતે આરોપી (૧) સંજય ગુપ્તા (રહે.દિલ્હી) (૨) ગુરૂચરણ શેઠી (રહે,પ્રતિક એપાર્ટમેન્ટ દાદાસાહેબના પગલા નવરંગપુરા) તથા (૩) રામઅવતાર સકસેના (રહે,યમુના વિહાર નોર્થ ઇસ્ટ દિલ્હી) નાઓએ ભેગા મળી “ડાયમન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડીંગ કું.” નામની કંપની ખોલી “પોતે બીજી ૧૫ બ્રાન્ચ ખોલવા માંગે છે” તેમ કહી ઓફીસ માટે ટી.વી.,એસ.સી., કોમ્પ્યુટર વિગેરે ઇલેક્ટ્રોનિક વસ્તુઓની જરૂરીયાત હોવાનું જણાવી પ્રથમ એક ટી.વી. તથા ત્રણ એસ.સી. મંગાવી તેનું બિલ ચુકવી વિશ્વાસ કેળવી, બીજા એ.સી.નંગ-૩, કોમ્પ્યુટર નંગ-૬, લેપટોપ નંગ-૮, પ્રિન્ટર નંગ-૪, ડીવીઆર નંગ-૮, કેબલ વાયર બંડલ-૮, બી.એન.સી.નંગ-૧૩૦, ડી.સી.કેબલ નંગ-૬૫, ૮ ચેનલ એસ.એમ.પી.એસ. નંગ-૮, હાર્ડડીસ્ક ૧ ટી.બી. નંગ-૮, તથા સી.સી.ટી.વી.કેમેરા-નંગ-૬૪, કુલ કિંમત રૂપિયા ૧૦,૧૪,૧૨૮/- તથા બીજા માણસોના લેપટોપ તથા ગાડી તથા મોબાઇલ ફોન મળી રૂપિયા ૬૪,૪૨,૫૦૦/- મળી કુલ રૂપિયા ૭૪,૫૬,૬૨૮/- મતાની ચીજવસ્તુનો માલ લઇ, માલના પૈસા નહી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી પી.બી.દેસાઇ ચલાવે છે.

સાયબર ક્રાઈમ: કૃણાલ શ્રીકાંતભાઈ દંતાણી (ઉ.વ.૨૪)(રહે.ઠાકોરવાસ, બસ સ્ટોપ પાછળ, જુના વાડજ સર્કલ, વાડજ) એ તા.૦૭/૦૫/૧૯ નારોજ સાયબર ક્રાઈમ ખાતે ફરીયાદ નોંધાવી છે કે જુલાઈ/૨૦૧૮ થી આજદિન સુધીના સમયગાળા દરમ્યાન priyainfo@email.quikr.com, indigoairline.11 @gmail.com, મોબાઇલ નંબર ૯૮૨૯૭૮૧૩૬૦, ૯૭૧૮૪૮૯૮૬૪, ૯૩૧૯૧૩૫૩૦૮ ના ધારકોએ ભેગામળી ઈન્ડીગો એરલાઇન્સમાં ગ્રાઉન્ડ સ્ટાફમાં નોકરી આપવાના બહાને ઓફર લેટર તેમજ જોઈનીંગ લેટર મોકલી આપી, કૃણાલને વિશ્વાસમાં લઈ રજીસ્ટ્રેશન ફી, કેન્ટીન, યુનિફોર્મ, બસ સુવિધા, સીક્યુરીટી ડીપોઝીટ પેટે કુલ રૂપિયા ૨૧,૩૫૦/- ભરાવી નોકરી નહીં આપી છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી એ.ડી.પરમાર ચલાવે છે.

ઘરફોડ ચોરી :-

સમાચાર યાદી નં.૭૯૭/૧૯

શહેરકોટડા: વિરેન્દ્રસિંહ પરબતસિંહ ઠાકોર (રહે.બોમ્બે હાઉસીંગ નુતનમીલ પાછળ સરસપુર) એ શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૭/૦૫/૧૯ કલાક ૧/૩૦ થી સવારના ૩/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના ખુલ્લા ઘરમાં અજાણી વ્યક્તિ પ્રવેશ કરી, તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ૧૬,૦૦૦/- તેમજ બે મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૯,૫૦૦/- મળી કુલ રૂપિયા ૧,૭૮,૫૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.આઈ.ચૌધરી ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૭૯૮/૧૯

ગોમતીપુર: અંજનીકુમાર અનીલસિંગ રાજપુત (રહે.રેલવે કોલોની ગોમતીપુર) એ અગમ્ય કારણસર તા.૭/૫/૧૯ કલાક ૬/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ઝેરી ગોળીઓ ખાઈ લીધી હતી. સારવાર માટે તેમને સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે ગોમતીપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પોસ.ઈ.શ્રી એસ.એમ.ડામોર ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.